

B.A. Sem-III
Core- 201: Economics
Principles of Economics-01 (New Course)

Time : 2:00 Hours]

Max Marks : 50

વિભાગ -I

નીચેના પ્રશ્નોમાંથી ગમે તે ત્રણના ઉત્તર લખો.

1. તુષ્ટિગુણ પદ્ધતિ પર આધારિત માંગનો નિયમ સમજાવો. **14**
2. સમતૃપ્તિની રેખાના લક્ષણો આકૃતિની મદદથી સમજાવો. **14**
3. ગ્રાહકની સમતુલા એટલે શું? તટસ્થરેખા પદ્ધતિ દ્વારા ગ્રાહકની સમતુલા સમજાવો. **14**
4. આવક અસર અને અવેજી અસર આકૃતિ સહિત સમજાવો. **14**
5. માંગની મૂલ્યસાપેક્ષતાનો અર્થ આપી, તેના પ્રકારો સમજાવો. **14**
6. માંગની મૂલ્યસાપેક્ષતાને અસર કરતા પરિબળો સમજાવો. **14**
7. ઉત્પાદન વિધેયનો ખ્યાલ આપી, તેના લક્ષણો અને પ્રકારો સમજાવો. **14**
8. પરિવર્તનશીલ સાધન સંયોજનનો નિયમ આકૃતિની મદદથી સમજાવો. **14**

વિભાગ-II

યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. (ગમે તે ચાર)

08

1. સામાન્યતઃ તટસ્થરેખાનો ઢાળ.....હોય છે.
(ઋણ, ધન)
2. વપરાશ અને સીમાંત તુષ્ટિગુણ વચ્ચે..... સંબંધ હોય છે.
(સમાંતર, વ્યસ્ત)
3. તટસ્થ રેખાનો નકશો ગ્રાહકની.....દર્શાવે છે.
(અભિરૂચિ, ખરીદશક્તિ)
4. સામાન્ય રીતે અવેજી અસર.....હોય છે.
(સ્થિર, ધન)
5. મોજશોખની વસ્તુ માટે આવક સાપેક્ષતા.....હોય છે.
(એકમ કરતા વધુ, એકમ કરતા ઓછી)
6. માંગની આવક સાપેક્ષતાના પ્રકારો છે.
(બે, ત્રણ)
7. અર્થશાસ્ત્રમાં ટૂંકોગાળો એટલે એવો ગાળો જેમાં.....
(કોઈ એક સાધન અસ્થિર હોય છે, બધા સાધન અસ્થિર હોય છે)
8. કદ વિકાસના મળતરનો પ્રથમ તબક્કો એટલે.....
(ઘટતા મળતર, વધતા મળતર)

B.A. Sem-III
Core - 201: Economics
Principles of Economics-01 (New Course)

Time : 2:00 Hours]

Max Marks : 50

Section -I

Attempt any **three** of the following questions.

1. Explain the law of demand on the basis of utility method. **14**
2. Explain the characteristics of indifference curve using a diagram. **14**
3. What is consumer equilibrium? Explain the consumer equilibrium by method of indifference curve. **14**
4. Explain the income effect and substitution effect with diagram. **14**
5. Give a meaning of elasticity of demand, Explain its types. **14**
- .6. Explain the factors affecting elasticity of demand. **14**
7. Give the concept of production function, Explain its characteristics and types. **14**
8. Explain the law of variable proportion using a diagram. **14**

Section - II

Fill in the blanks by choosing the correct option: **(Any four)**

08

- (1) Usually the slope of the indifference curve is
(negative, positive)
- (2) There is relationship between consumption and marginal utility.
(parallel, inverse)
- (3) The indifferent curve map shows the consumers.....
(Aptitude, purchasing power)
- (4) Usually the substitute effect is
(steady, positive)
- (5) For luxury goods income elasticity of demand is
(greater than one, less than one)
- (6) types of income elasticity of demand are there.
(two, three)
- (7) In economics short run refers to
(only one variable is factor, all factors are variable)
- (8) The first phase of returns of scale means.....
(diminishing returns, increasing returns)